

ગુજરાત જાહેર સેવા આયોગ

રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા ઉમેદવારોની યાદી

:: સુધારા યાદી ::

વંચાણે લીધી:(1) આયોગની તા.03.04.2017ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી.

(2) આયોગની તા.29.09.2017ની રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદી

1. તબીબી અધિકારી (આયુર્વેદ)/નિવાસી તબીબી અધિકારી (આયુર્વેદ), વર્ગ-2ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક: 24/2016-17 ના સંદર્ભમાં આયોગ દ્વારા તા.23.10.2016 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે અરજી ચકાસણીને પાત્ર થતા કુલ: 2478 ઉમેદવારોના બેઠક નંબરોની યાદી આયોગની કચેરી દ્વારા તા.03.04.2017ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આ ઉમેદવારોની અરજી ચકાસણીને અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર થતા કુલ: 1947 ઉમેદવારો ની યાદી આયોગની કચેરી દ્વારા તા.29.09.2017ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.

2. આયોગની કચેરી દ્વારા તા.03.04.2017ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ અરજી ચકાસણીને પાત્ર થતા કુલ: 2478 ઉમેદવારોની યાદીમાં (1) બિન અનામત (કોમન) વર્ગના બેઠક નં.101004821, (2) બિન અનામત (મહિલા) વર્ગના બેઠક નં.101004405 અને (3) સા.શૈ.પ.વર્ગ (મહિલા) વર્ગના બેઠક નં.101001900 પરના ઉમેદવારોનો તેઓ જે તે કેટેગરી માટે આયોગે નિયત કરેલ લાયકી ધોરણ ધરાવતા હોવાથી અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ હતો. અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી હેઠળની નોંધ: 3 થી “અરજી ચકાસણીને પાત્ર ઠરેલ આ ઉમેદવારોને, આ જાહેરાતના અનુસંધાને તેમણે કરેલ ઓન-લાઇન અરજીની પ્રિન્ટેડ નકલ, જરૂરી દસ્તાવેજો સાથે આયોગની કચેરીમાં સંયુક્ત સચિવશ્રી (આર-5)ને મોડામાં મોડુ તા.18.04.2017 સુધીમાં મળે તે રીતે મોકલી આપવા જણાવવામાં આવેલ હતું.”

3. અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારોની અરજી ચકાસણી (Scrutiny) કરતાં વિચારણા હેઠળના આ ઉમેદવારોએ આ જાહેરાતના અનુસંધાને તેમણે કરેલ ઓન-લાઇન અરજીની પ્રિન્ટેડ નકલ, જરૂરી દસ્તાવેજો સાથે આયોગની કચેરીમાં જમા કરાવેલ ન હોય, સંબંધિત ભરતી શાખાની તા.14.09.2017ની નોંધથી મળેલ પાત્રતા/અપાત્રતા દર્શાવતા પત્રકની વિગતોને આધારે તા.29.09.2017ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ રૂબરૂ મુલાકાતને પાત્ર થતા ઉમેદવારોની યાદી હેઠળની નોંધ (૧): “આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing standard) ધરાવે છે, પરંતુ જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરતા ન હોય રૂબરૂ મુલાકાતને પાત્ર થતા નથી.” માં (1) બિન અનામત (કોમન) વર્ગના બેઠક નં.101004821, (2) બિન અનામત (મહિલા) વર્ગના બેઠક નં.101004405 અને (3) સા.શૈ.પ.વર્ગ (મહિલા) વર્ગના બેઠક નં.101001900 પરના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલ હતો.

4. સંબંધિત ભરતી શાખાની તા.13.11.2017ની નોંધના અવતરણ મુજબ વિચારણા હેઠળના આ ત્રણેય ઉમેદવારોએ આ જાહેરાત ના અનુસંધાને તેમણે કરેલ ઓન-લાઇન અરજી ની પ્રિન્ટેડ નકલ, જરૂરી દસ્તાવેજો સાથે આયોગની કચેરીમાં જમા કરાવ્યાના આધાર / પુરાવા રજૂ કરેલ હોય, ઉમેદવારોની અરજી ચકાસણી (Scrutiny) કરતાં (1) બેઠક નં.101004821, (2) બેઠક નં.101004405 અને (3) બેઠક નં.101001900 પરના ઉમેદવારો જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરતા હોય, તેમજ તેઓ રૂબરૂ મુલાકાત માટે પાત્રતા ધરાવતા હોય, (1) બેઠક નં.101004821, (2) બેઠક નં.101004405 અને (3) બેઠક નં.101001900 પરના ઉમેદવારોની રૂબરૂ મુલાકાત માટેની પાત્રતા આયોગના તા.14.10.1986ના કચેરી હુકમથી નક્કી થયેલ માપદંડ અનુસાર નક્કી કરવાની થાય.

5. આથી આ જાહેરાતમાં જણાવેલ (1) બિન અનામત (કોમન) વર્ગના ઉમેદવારોની કુલ 115 જગ્યાઓ સામે નોર્મ્સ મુજબ કુલ: 345 ઉમેદવારો (2) બિન અનામત (મહિલા) વર્ગના ઉમેદવારો ની કુલ 57 અનામત જગ્યાઓ સામે નોર્મ્સ મુજબ કુલ: 171 ઉમેદવારો અને (3) સા.શૈ.પ.વર્ગ (મહિલા) વર્ગના ઉમેદવારોની કુલ 28 અનામત જગ્યાઓ સામે નોર્મ્સ મુજબ કુલ: 84 ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે પાત્ર જાહેર કરવાના રહે.

6. (1) બિન અનામત (કોમન) વર્ગના ઉમેદવારોની મેરીટ યાદી ધ્યાને લેતાં બેઠક નં.101004821, (2) બિન અનામત (મહિલા) વર્ગના ઉમેદવારોની મેરીટ યાદી ધ્યાને લેતાં બેઠક નં.101004405 અને (3) સા.શૈ.પ.વર્ગ (મહિલા)વર્ગના ઉમેદવારોની મેરીટ યાદી ધ્યાને લેતાં બેઠક નં.101001900 પરના ઉમેદવારો આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing standard) ધરાવતા હોવાથી તા.29.09.2017ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા ઉમેદવારોની યાદીમાં સમાવેશ કરવાનો થાય.

7. આથી તા.29.09.2017ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ રૂબરૂ મુલાકાતને પાત્ર થતા ઉમેદવારોની યાદી હેઠળની નોંધ: 4 (1): “આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ ધરાવે છે, પરંતુ જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરતા ન હોય રૂબરૂ મુલાકાતને પાત્ર થતા નથી.” માંથી (1) બેઠક નં.101004821, (2) બેઠક નં.101004405 અને (3) બેઠક નં.101001900ને રદ કરવામાં આવે છે, આમ થતાં રૂબરૂ મુલાકાતને પાત્ર થતા ઉમેદવારોની યાદી હેઠળની નોંધ 4 (1) ના ઉમેદવારોની કુલ સંખ્યા 97 અને રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા ઉમેદવારોની કુલ સંખ્યા 1950 થશે. આયોગની કચેરી દ્વારા તા.29.09.2017ના રોજ પ્રસિદ્ધ થયેલ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીની અન્ય વિગતો યથાવત રહેશે.

સ્થળ: ગાંધીનગર-382010

તારીખ: 20.11.2017

સંયુક્ત સચિવ

ગુજરાત જાહેર સેવા આયોગ